

જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦

ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૪/૫/૨૦૧૫ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૦૪૩/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૬ કેસ કરી ૪૦ વ્યક્તિઓને ઝડપી, ૨૧૯ લીટર દેશી દારૂ, ૨૪૯ બોટલ ઇંગ્લીશ દારૂ, ૮૮ ક્વોર્ટર ઇંગ્લીશ દારૂ અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૧ વ્યક્તિને ઝડપી રોકડ રૂપિયા ૧૫૩૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૪૪/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી. ૯૩ મુજબ ૦૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ગાડીનો કાય તોડી ચોરી :-

સમાચાર યાદી નં.૧૦૪૫/૧૫

સોલા હાઇકોર્ટ : વિક્રમભાઈ શ્રીરામ રાઉન (રહે,વંદેમાતરમ સીટી, ચાંદલોડીયા) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૫/૧૫ સાંજના ૭/૦૦ થી ૮/૧૫ વાગ્યા દરમ્યાન, એસ.જી.હાઇવે, હેબતપુર ત્રણ રસ્તા ખાતે આવેલ જાયડસ હોસ્પિટલ બહાર પોતાની હુન્ડાઈ કાર તેમજ તેની પાસે સાહેદ શરદભાઈ રાવસાહેબ પાટીલ નાઓની હોન્ડા સીટી કાર પાર્ક કરી મુકી હતી દરમ્યાન કોઈ અજાણી વ્યક્તિ બંને કારનાં ખાલી સાઇડનાં કાય તોડી, બંને કારમાંથી એક-એક લેપટોપ મળી કુલ બે લેપટોપ કુલ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- મતાનાં અને જરૂરી દસ્તાવેજોની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી શીવાભાઈ નાઓ ચલાવે છે.

વાહનચોરી :-

સમાચાર યાદી નં.૧૦૪૬/૧૫

ઘાટલોડીયા : મહેન્દ્રભાઈ કાંતિભાઈ પંચાલ (રહે,શક્તિનગર સોસાયટી, સર્વોદય સ્કુલની પાછળ, ઘાટલોડીયા) એ તા.૨૩/૫/૧૫ નારોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૫/૧૫ સવારના ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક પોતાની મારૂતી ફંટી કાર નંબર જીજે.૧.એચ.કે.૫૭૩૯ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- પાર્ક કરી હતી. જે કારની કોઈ અજાણી વ્યક્તિ તા.૨૧/૫/૧૫ સવારનાં ૬/૩૦ વાગ્યા દરમ્યાન ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી નરસિંહભાઈ કુબાભાઈ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૦૪૭/૧૫

એલીસબ્રીજ : મહંમદસાવેઝ મહંમદફારુક શેખ (રહે: આબાદ એસ્ટેટ ડ્રીમ લેન્ડ સોસાયટી, ઇસનપુર) એ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૫/૧૫ સવારનાં ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ભાઈ મહંમદસાહીલ મહંમદફારુક શેખ (ઉ.વ.૨૨) ચંદ્રનગર સાંઇબાબા મંદિર સામેથી થઇ રહ્યા હતા દરમ્યાન આરોપી નટવરભાઈ સોમાભાઈ મકવાણા (રહે.બેતાલીસની કોલોની, ખોડીયારનગર સામે છાપરા, બહેરામપુરા) એ પોતાની લોડીંગરીક્ષા નંબર જીજે.૧.બી.એક્સ.૯૦૩૫ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી, મહંમદસાહીલને ટક્કર મારતાં, શરીરે ગંભીર ઇજાઓ થતાં, તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સી.ડી.વૈશ્યક ચલાવે છે.

લીફ્ટ તુટી પડતાં મૃત્યુ :

સમાચાર યાદી નં.૧૦૪૮/૧૫

ખાડીયા : વિક્રમભાઈ મહેંદ્રભાઈ વણજારા (ઉ.વ.૧૮)(રહે.શીવાનંદનગર, નાગરવેલ હનુમાન, અમરાઇવાડી) તા.૨૩/૫/૧૫ સાંજનાં ૬/૩૦ વાગ્યાના સુમારે રાયપુર ભજીયા હાઉસ પાસે કોટની રાંગ પાસે આવેલ જોષી હોલમાં કાપડનો માલ લઇ, નીચેના માળેથી લીફ્ટમાં માલ મુકી, બીજા માળે જતાં હતા દરમ્યાન અચાનક લીફ્ટ તુટી જતાં, વિક્રમભાઈને શરીરે ગંભીર ઇજાઓ થતાં, સારવાર અર્થે તેમને વા.સા.હોસ્પીટલમાં દાખલા કરવામાં આવેલા હતા. જ્યાં સારવાર દરમ્યાન સાંજનાં ૭/૧૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે ખાડીયા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી પી.ડી.પરમાર ચલાવે છે.

આત્મહત્યા :

સમાચાર યાદી નં.૧૦૪૯/૧૫

સાબરમતી : તા.૨૩/૫/૧૫ બપોરના ૧/૪૫ વાગ્યાના સુમારે ચીમનભાઈ બ્રીજ નીચે એક અજાણી સ્ત્રી કોઇ કારણસર પોતાની જાતે પેટ્રોલ જેવું પ્રવાહી છાંટી, સળગી જઇ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી રસીકભાઈ વિઠ્ઠલભાઈ ચલાવે છે.

(ઇ.ચા.)નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.